

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાનામવા સર્કલ સ્થિત ICCC ખાતે ફ્રીડમ થ્રુ ટેકનોલોજી (Freedom Through Technology) અંગે સેમીનાર યોજાયો

તારીખ: ૦૧-૧૦-૨૦૨૧



મહાનગરપાલિકાના નાનામવા સર્કલ પર આવેલ ICCC (Integrated Command And Control Center) ખાતે "ફ્રીડમ થ્રુ ટેકનોલોજી" (Freedom Through Technology) અંગે એક સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં રાજકોટ શહેરનાં જુદી જુદી કોલેજનાં પ્રોફેસરો / લેકચરર તથા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લી.નાં CEO તેમજ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર શ્રી ચેતન નંદાણી, ડાઈરેક્ટર (આઈ.ટી. વિભાગ) શ્રી સંજય ગોહેલ તથા આસીસ્ટન્ટ મેનેજર શ્રી વત્સલ પટેલ તેમજ કર્મચારીશ્રીઓ પણ હાજર રહેલ હતા.

આ સેમીનારમાં ટેકનોલોજીનાં ઉપયોગ વડે લોકોની સુખાકારી તેમજ સલામતી વધે તે અંગે એક પ્રેઝન્ટેશનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં ICCCનાં જુદા જુદા કમ્પોનન્ટ જેવા કે સી.સી.ટી.વી. કેમેરાનું સંચાલન/ વોટર સ્કાડા, ડ્રેનેજ સ્કાડા, ઓટોમેટિક ટિકીટ કલેક્શન સિસ્ટમ (ATCS), ઇન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ (ITMS), જુદા જુદા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) ડીવાઈસ, ડેટા સેન્ટર (DC)ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત લોકોને ICCC નાં જુદા જુદા ફંક્શનથી વાકેફ કરવામાં આવેલ.

આ ઉપરાંત આ સેમિનારમાં ઉપસ્થિત સમુદાયને આ પ્રોજેક્ટની ઉપયોગીતા અંગે માહિતી આપતા નાયબ કમિશનર શ્રી ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીનાં સહયોગ સાથે સ્માર્ટ સિટી મિશનનાં પ્રોજેક્ટ હેઠળ "આઈ-વે પ્રોજેક્ટ" હેઠળ સમગ્ર રાજકોટ શહેરમાં ૧૦૦૦ જેટલા સીસીટીવી કેમેરાનું વિશાળ નેટવર્ક ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. સેઈફ એન્ડ સિક્યોર રાજકોટનાં કન્સેપ્ટ સાથેનાં આ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર - ICCC (Integrated Command And Control Center) બનાવવામાં આવેલ છે.

નાયબ કમિશનરશ્રીએ વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, આઈ-વે પ્રોજેક્ટ શહેરમાં ઇન્સીડન્ટ મેનેજમેન્ટમાં ખુબ જ મદદરૂપ પૂરવાર થઈ રહેલ છે. ઉદાહરણ તરીકે વાવાઝોડા અને ભારે વરસાદના પડકારરૂપ સંજોગોમાં સમગ્ર શહેરની સ્થિતિ પર સતત નજર રાખી આવશ્યકતા અનુસાર ત્વરિત પગલાં લઈ શકાય છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં વિવિધ સ્થળોએ પોતાના સંકુલ અને પ્લોટ ધરાવે છે. આ સંજોગોમાં એસ્ટેટ મેનેજમેન્ટની કામગીરીમાં પણ આઈ-વે પ્રોજેક્ટ ઉપયોગી

થઈ રહ્યો છે. સાથોસાથ શહેર પોલીસને ગુન્હાની તપાસમાં તેમજ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પણ આ પ્રોજેક્ટ એટલો જ મદદરૂપ થઈ રહ્યો છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાલ ફેઝઝ-૨ માં શહેરમાં વિવિધ સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ બનાવવામાં આવેલ છે. મનપાની આ પહેલને નાગરિકો દ્વારા ખુબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સાથોસાથ બી.આર.ટી.એસ. બસ સ્ટોપ ખાતે ટર્નસ્ટાઈલ ગેઈટ બનાવવામાં આવ્યા છે. તો શહેરમાં વિવિધ સ્થળોએ એલ.ઈ.ડી. સ્ક્રીન અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડિજિટલ હાઈ-વે અંગેની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

આ સેમિનારમાં ઉપસ્થિત સૌ પ્રોફેસર, લેક્ચરર અને છાત્રોએ મહાનગરપાલિકાની ઉપરોક્ત કામગીરી અને આધુનિક જમાનાને અનુરૂપ વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવી વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા